

RAN-2501001206030803
B.A. (Sem.- VI) Examination March - 2026
Home Science - Major - 16
Family Finance Management
Time: 1:30 Hours]
[Total Marks: 35

સૂચના : / Instructions (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી. Fill up strictly the above details on your answer book	Seat No.: Student's Signature
---	--

- પ્ર.1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. (ગમે તે પાંચ) 10**
1. શેરના પ્રકારો જણાવો.
 2. ફરજિયાત બચતના પ્રકારો જણાવો.
 3. ઉધારના પ્રાપ્તિ સ્થાનો જણાવો.
 4. અપ્રત્યક્ષ વાસ્તવિક આવકનાં પ્રાપ્તિ સ્થાના જણાવો.
 5. બજેટ બનાવવાની પદ્ધતિના તબક્કાઓ લખો.
 6. N.S.C. અને K.V.P. નું પૂરું નામ લખો.
 7. ક્રેડિટ શબ્દની ઉત્પત્તિ અને તેનો અર્થ જણાવો.
- પ્ર.2. બચત એટલે શું? પોસ્ટ ઓફિસની યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપો. 13**
- અથવા**
- પ્ર.2. અ. નાણાંકીય આવકના પ્રાપ્તિ સ્થાનો જણાવો. 07**
- બ. નાણાંકીય વ્યવસ્થાનો આયોજનનો તબક્કો. 06**
- પ્ર.3. ક્રેડિટ એટલે શું? ક્રેડિટનું મહત્વ જણાવી, તેના પ્રકારો ઉદાહરણ આપી સમજાવો. 12**
- અથવા**
- પ્ર.3. અ. વીમાના કોઈપણ ત્રણ પ્રકારો વિશે વિસ્તારથી સમજાવો. 06**
- બ. બજેટની ઉપયોગિતા અને બજેટ બનાવતી વખતે ધ્યાનમાં રાખવાના પરિબળો 06**

ENGLISH VERSION

- Q.1. Write short answer to the following questions: (any five) 10**
1. State the types of share.
 2. State the types of compulsory savings.
 3. State the places where loans are obtained.
 4. State the sources of indirect real income.
 5. Write the stages of budgeting method.
 6. Write the full name of N.S.C. and K.V.P.
 7. State the origin of the word credit and its meaning.

Q.2.	What is savings? Give detailed information about post office schemes.	13
	OR	
Q.2.	A. State sources of financial income.	07
	B. Planning stage of financial planning.	06
Q.3.	What is credit? State the importance of credit and explain its types with examples.	12
	OR	
Q.3.	A. Explain any three types of insurance	06
	B. Usefulness of budget and factors to keep in mind while preparing budget.	06
